

શિક્ષણ અને સમાજ
કલ્યાણ કેન્દ્રનું
માસિક મુખ પત્ર



વર્ષ : ૧૨

અંક : ૫

સામાન્ય સભા

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રની વાર્ષિક સામાન્ય સભા તારીખ ૧૩/૦૬/૨૦૧૦ નાં રોજ ૧૫-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. નીચે દર્શાવેલ કાર્યસૂચિ મુજબના કામકાજ માટે મળશે તો તમામ સામાન્ય સભ્યોએ ઉપસ્થિત રહેવા વિનંતી છે.

સ્થળ : ૨૬-ઓમનગર(૩), જીઆઈડીસી પાછળ, હનુમાનપરા રોડ, અમરેલી.

કાર્યસૂચિ

૧. ગત સાધારણ સભાની કાર્યવાહી નોંધ વંચાણે લઈ મંજૂર કરવા બાબત.
૨. ગત વર્ષનો હિસાબ, અંદાજપત્ર તથા વાર્ષિક અહેવાલની મંજૂરી બાબત.
૩. સમિતીઓમાં થયેલ કાર્યવાહીને બહાલી આપવા બાબત
૪. આગામી કાર્યક્રમો અંગે
૫. અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય તે

તા. ૩૦/૦૫/૨૦૧૦

પ્રમુખ

ખાસ નોંધ: સામાન્ય સભામાં જો કોઈ સભ્યોએ પ્રસ્તાવ પ્રશ્ન કે ઠરાવ મુકવાના હોય તો બેઠકના ચાર દિવસ અગાઉ મંત્રીશ્રીને મોકલી આપવાના રહેશે જેની નોંધ લેવા વિનંતી છે.

પ્રિય વાંચકો,

ટપક આપ સૌને નિયમિત મોકલી રહ્યા છીએ તેના ખર્ચને પહોંચી વળવા આપ, સહયોગ રાશિ મોકલી શકો છો. ટપકને મોકલવામાં આવનાર આ રકમ ચેક અથવા ડ્રાફ્ટ થી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનાં નામે મોકલવા વિનંતી છે.

આપની આસપાસ બનતા બનાવો કે જે બીજા લોકો માટે અનુકરણીય હોય તેની વિગતો ટપકને મોકલી શકો છો તેથી અન્ય લોકો તે વિશે માહિતગાર બનશે.

*** આ માસના શુભેચ્છકશ્રીઓ ***

* ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારકા રૂા. ૧૦૦૦/-

* શ્રી હરેશ પાનસુરીયા રૂા. ૫૦૦/-

- ટપક ટીમ

વિશાળતા એ જ જીવન છે, સંકુચિતતા મૃત્યુ છે.

વાર્ષિક સંમેલન

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનું એકત્રીસમું વાર્ષિક સંમેલન ૧૩/૦૬/૨૦૧૦ નાં રોજ સવારના ૦૮-૦૦ કલાકે સંસ્થાના અમરેલી કાર્યાલય પર રાખવામા આવેલ છે. સંસ્થા સાથે જોડાયેલ તમામ સંસ્થાઓ, સંસ્થાના સાથી મિત્રો, ભુતપુર્વ તથા હાલના સ્ટાફગણ, સંસ્થાના સભાસદો, શુભેચ્છકો સૌને આ સંમેલનમાં ભાગ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સંમેલનમાં આપના પ્રતિભાવો / સૂચનો આવકાર્ય છે.

એસ.એસ.કે.કે. પરિવાર

વર્ષા વીમો

પાક આધારિત જોખમોમાં વરસાદના કારણો મુખ્યત્વે હોય, એગ્રીકલચર ઈન્સ્યોરન્સ કંપનીએ છેલ્લા ત્રણ વર્ષથી વર્ષા વીમાની યોજના ખેડુતો માટે શરૂ કરેલ છે. જેમાં સામાન્યરીતે બીયારણ તથા મજુરી જેવી નાની રકમો સામે વળતર મળે છે.

એસએસકેકે એ છેલ્લા બે વર્ષથી ખાંભા તાલુકામાં ખેડુતોને વર્ષા વીમા સંબંધી જાણકારી આપી લગભગ ૨૨ ગામના ખેડુતોને સામેલ

કર્યા છે. જેમાં મહિલાઓ, નાના અને સીમાંત ખેડુતોને જોડવાનો સંસ્થાનો પ્રયાસ રહ્યો છે. આગલા બંને વર્ષોમાં ૨૫૦ જેટલા ખેડૂત ભાઈ બહેનો જોડાયા હતા.

આ વર્ષે મગફળી અને કપાસના વાવેતરમાં ૧૩.૮૨ ટકા પ્રિમિયમમાં ૭.૮૨ ટકા નાબાઈ તરફથી સહાય પ્રાપ્ત થઈ છે. જેથી ખેડુતોને રૂ. ૮૩૮/- ના પ્રિમીયમ સામે માત્ર રૂ. ૨૮૮/- ભરવાના થશે. જેનાથી રૂ. ૫૦૦૦/-નુ રક્ષણ મળવાપાત્ર થાય છે.

આ બાબતે સંસ્થાના ખાંભા કાર્યાલય ખાતે ખેડુતોની એક તાલીમ રાખવામાં આવી હતી જેમાં ઓટોમેટીક વેધર સ્ટેશન તથા વર્ષાવીમાની આ વર્ષની પ્રોડક્ટની બાબતો ખેડુતો સુધી પહોચાડવા માટે તા. ૨૫/૫/૧૦ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું

તા. ૩૧ મે, ૨૦૧૦ થી વર્ષાવીમા અભિયાન શરૂ થનાર છે. જેમા ખેડુતોના ખેતિ સામેના અન્ય જોખમોની ચર્ચા સાથે વરસાદ આધારીત જોખમ સામે રક્ષણ મેળવવા માટે જોડાનાર ખેડુતોના પ્રિમિયમ સ્વીકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કુદરતી સંશોધનોની જાળવણી માટે અગ્રેસર સ્વૈ. સંસ્થાઓના સંગઠન સજ્જતા સંઘ, નાબાઈ અને ઓકસફાર્મનો આ કાર્યને ટેકો સાંપડેલ છે.

પ્રત્યેક નવુ પ્રભાત કોઈક નવી પ્રગતિની શક્યતા લાવે છે.

આહાર અને પર્યાવરણ

આહાર અને પર્યાવરણ એ માનવ જીવન માટે જરૂરીયાતની વસ્તુ છે. પર્યાવરણ સારું હશે તો આહાર માટે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ પર્યાવરણ જોખમાય તો આહાર માટે મુશ્કેલી સર્જાય. આપણા પર્યાવરણની અસર આપણા આહાર ઉપર જોવા મળે છે. પર્યાવરણની જાળવણી કરીએ તો આહાર માટે મુશ્કેલીઓ નહીં સર્જાય જ્યારે કોઈ આપણને પુછે છે કે તમે શું ખાવ છો ? તો આપણે એવું વિચારીએ છીએ કે તે આપણી અંગત બાબત છે તો આપણો આહાર પર્યાવરણને કઈ રીતે અસર કરે છે તે આપણે જાણવું જોઈએ.

❖ તમે માનો કે ન માનો પણ ગાય, ભેંસ ગ્રીન હાઉસ ઈફેક્ટ ઉત્પન્ન કરવામાં મહત્વનું યોગદાન પ્રદાન કરે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વની ૧૩ કરોડ ગાય અને ભેંસ વાર્ષિક લગભગ ૧૦ કરોડ ટન મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. જે ગ્રીન હાઉસ ઈફેક્ટ માટે સૌથી વધુ શક્તિશાળી છે અને જેનો પ્રત્યેક કણ કાર્બન ડાયોક્સાઈડનાં કણ કરતાં ૨૫ ગણી વધુ ગરમીનો સંગ્રહ કરે છે.

❖ અમેરિકામાં પશુઓ, ગાય, ભેંસ, વાછરડાં, ડુકકર, ઘેટા, બકરા વગેરે ઢોરોનાં પશુપાલનમાં આખાય અમેરિકાનાં સંપૂર્ણ વપરાશનાં અડધા કરતા પણ વધુ પાણીનો ઉપયોગ થાય છે.

❖ ઉત્તર અમેરિકામાં એક તૃતીયાંશ કરતાં વધુ

જમીન ફક્ત ઘાસ પેદા કરવામાં ગૌચર તરીકે વપરાય છે. અમેરિકાની અનાજ પેદા કરતી જમીનમાં અડધા કરતાં વધુ જમીન ફક્ત પશુઓ માટે જ અનાજ ઉગાડવા વપરાય છે. જે પશુઓનો માંસ તથા ડેરી પેદાશોમાં ઉપયોગ કરવામાં આવે છે.

❖ ૨૨ કરોડ એકર જમીન ઉપરનાં જંગલોનો ફક્ત પશુપાલન માટે નાશ કરવામાં આવ્યો છે.

❖ બ્રાઝિલમાં ઓસ્ટ્રીયા દેશ જેટલી અર્થાત ૨૫૦ લાખ એકર જમીન અને મધ્ય અમેરિકામાં અડધા કરતાં વધુ જમીન ઉપરનાં જંગલો ફક્ત માંસ ઉત્પાદન માટે સફાઈ કરવામાં આવ્યા છે.

❖ પશુઓમાંથી મેળવવામાં આવતા આહારનાં કાચા માલની કિંમત, આખાય અમેરિકામાં ઉપયોગમાં આવતા ખનિજ તેલ, ગેસ અને કોલસાની કિંમત કરતાં ખુબ જ વધારે છે.

❖ માંસ અને ડેરી પેદાશોમાં કાચા માલ તરીકે જેટલાં ધાન્ય, શાકભાજી, ફળો, ખોરાક તરીકે વપરાય છે.

❖ ડાયેટ ફોર એ ન્યૂ અમેરિકા પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે જો અમેરિકન પ્રજા તેમના ખોરાકમાં ફક્ત ૧૦ ટકા માંસનો ઘટાડો કરે તો, સમગ્ર વિશ્વમાં દર વર્ષે અનાજ વગર ભુખે મરતા ૬ કરોડ લોકોને સહેલાઈથી પોષી શકાય તેટલું અનાજ તેમજ સોયાબીન બચાવી શકાય.

(સાભાર - પર્યાવરણ મિત્ર)

સુખી થવાની ત્રણ ચાવી છે શ્રમ, સહનશીલતા અને ધીરજ.

ધ્યેય સારૂ હશે તો જીંદગી સારી જશે.

ધ્યેય : GOAL

G-Go ahead - આગળ વધો

O-Over all Plan - સંપૂર્ણ આયોજન

A-Action - ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય

L-Love your work - કાર્યમાં રસ લો

જીવનમાં સફળતા માટે કાર્યનું આયોજન કરવું અને તે પ્રમાણે જીવનને પ્રગતિમય બનાવવા માટે ધ્યેયનો નિર્ણય અને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રમાણીકતા પુર્વકનાં પ્રયત્નો જરૂરી છે.

જીવનમાં એક ધ્યેય હોઈ શકે છે આ ધ્યેય કારકિર્દીનું, વ્યક્તિગત પ્રગતિનું, સામાજિક પ્રતિષ્ઠાનું અથવા અંગત ટેવોને સુધારવાનું હોઈ શકે છે. અમુક ધ્યેય અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ શકતા હોય છે, જ્યારે અમુક ધ્યેય દીર્ઘ સમય બાદ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ આદતમાંથી છુટકારો મેળવવાનું ધ્યેય ટુંકા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે જ્યારે વ્યાવસાયિક સફળતા માટેનું ધ્યેય દીર્ઘકાલીન હોઈ શકે છે. ધ્યેય પામવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે.

ધ્યેયની સ્થાપના :-

તમે જે ધ્યેય સિધ્ધ કરવા માંગો છો તેની મુલવણી કરો, ત્યાર બાદ તમારી પ્રગતિ અને આનંદભર્યા જીવન માટે ક્યાં લક્ષણો અગત્યનાં છે તેની તારવણી કરો. દરેક ધ્યેય માટે વિચારો અને અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરો. તમારા ધ્યેય વિશે તમે પોતે સ્પષ્ટ હોવા જોઈએ. મારે

સારી કારકિર્દી અપનાવવી છે. મારે સારા વેપારી બનવું છે. આ બાબતો ધ્યેય સ્પષ્ટ દર્શાવતી નથી. તમારે શું કારકિર્દી અપનાવવી છે ? શું વ્યવસાય કરવો છે ? જો તે સ્પષ્ટ હશે તો જ તમે સાચી દિશામાં ધ્યેય પ્રાપ્તિ માટે પગલા લઈ શકો છો. તમારું ધ્યેય લાગણીઓ અથવા આકર્ષણ આધારીત ન હોવું જોઈએ. તમારું લક્ષ વાસ્તવિક અને પરીણામલક્ષી હોવું જરૂરી છે.

સમયનું આયોજન :-

લક્ષ નક્કી કર્યા બાદ તે પ્રાપ્ત કરવા માટે સમયનાં આયોજનની જરૂર પડે છે. તમે ધ્યેય કેટલા સમયમાં પ્રાપ્ત કરવા માંગો છો તે સ્પષ્ટ હોવું જોઈએ. જે લક્ષ સિધ્ધ જ ના થવાનું હોય તે લક્ષ માટે વાતો કરવી નિર્રથક છે માટે સમયનું આયોજન વાસ્તવિકતા ઉપર કરો. ધ્યેય પ્રાપ્તિ માટેનાં સમયનું આયોજન તમારી શક્તિઓ, ખામીઓ અને પ્રાપ્ત સાધન-સંપત્તિ ઉપર ઘણો મોટો આધાર રાખે છે. તમારા ધ્યેય પ્રાપ્તિ માટે વાસ્તવિકતાનાં આધારે સમયરેખા નક્કી કરો અને ત્યાર બાદ તે સમયપત્રકને વળગી રહેવા પુરતો પ્રયત્ન કરો.

ધ્યેય પ્રાપ્તિ માટે કોની મદદ લેશો ?

જીવનમાં ઘણા કાર્યો પુર્ણ કરવા માટે બીજી વ્યક્તિઓનો સહારો લેવો પડે છે. એક સારા વ્યવસાયી બનવા માટે તમારા કાર્યમાં સાથ આપનાર વ્યક્તિની જરૂર પડશે. એક સારા

હૃદયપુર્વક કરેલું કાર્ય સંતોષ અને શાંતિ આપે છે.

ડોક્ટર બનવા માટે સારી હોસ્પિટલમાં અનુભવ લેવો પડશે. એક સફળ વકીલ બનવા માટે એક સફળ વકીલની જરૂર પડશે. ધ્યેય પ્રાપ્તિ માટે યોગ્ય વ્યક્તિની મદદ લેતા શીખો તેમજ બીજાના અનુભવોમાંથી શીખો.

ધ્યેય પ્રાપ્તિ માટે વર્તમાનમાં તકલીફો સહન કરતાં અને બલિદાન આપતા શીખો :-

ધ્યેય પ્રાપ્તિ માટે તમારી મનગમતી વસ્તુનો ભોગ આપવો પડે, વ્યાવસાયિક સફળતા માટે આનંદ પ્રમોદનો ભોગ આપવો પડે. ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરવા બીજે ભણવા જવું પડે અને કુટુંબથી દુર રહેવું પડે, પરંતુ જ્યારે ધ્યેય પ્રાપ્તિનો આનંદ મળે છે, ત્યારે તમને બલિદાનનો અફસોસ થતો નથી.

ધ્યેય પ્રાપ્તિ માટે જીવનને સમતોલ કરતાં શીખો :-

ધ્યેય પ્રાપ્તિ માટે તેમાં જ રચ્યા પચ્યા ના રહેશો, જેનાથી બીજા ક્ષેત્રમાં તમને હાનિ પહોંચે. તમારી સફળ વ્યાવસાયિક કારકિર્દીનું ધ્યેય તમારા કુટુંબથી તમને દુર ના કરે તેનું ધ્યાન રાખો. અભ્યાસક્ષેત્રે સફળતા મેળવવાની લગનીમાં સમાજ, મિત્રો અને વર્તમાનથી સંપૂર્ણ અલિપ્ત બની ના જવાય તેની દરકાર રાખો.

ધ્યેય પ્રાપ્તિ માટે જીવનને સમતોલ રાખવું ખુબ જ જરૂરી છે જેથી તમે ધ્યેય પ્રાપ્તિનાં પરીણામો ખુશીથી માણી શકો. તમારી ધ્યેય પ્રાપ્તિથી તમારા કુટુંબ અને સમાજને ફાયદો થશે તો

તમને વધુ આનંદ આવશે.

ધ્યેયપ્રાપ્તિ માટે તમારી શક્તિ અને સાધન સંપત્તિનું આયોજન :-

ધ્યેય પ્રાપ્તિ માટે તમારી કઈ શક્તિઓ અને સાધન સંપત્તિનો તમે ઉપયોગ કરી શકશો તેની નોંધ કરો દા.ત. તમારી બુધ્ધિ, તમારી મહેનત કરવાની શક્તિ, સારું સ્વાસ્થ્ય, સુઝ, વક્તૃત્વ, મિત્રતા ભર્યો સ્વભાવ, તમારું સમાજમાં સ્થાન, કુટુંબમાંથી મળતી મદદ વગેરેનો, તમારા સદગુણો અને સાધન સંપત્તિનો પ્રમાણિકતાથી અને વાસ્તવિકતાથી વિચાર કરી, તેઓનો તમારી ધ્યેય પ્રાપ્તિ માટે ઉપયોગ કેવી રીતે કરશો તેનું આયોજન કરો. ઘણી વખત તમારી શક્તિઓથી તમે અજાણ હો છો. ધંધો કરવા માટે પૈસા જોઈતા હોય તો તમારી પાસેનો જમીનનો વધારાનો ટુકડો મદદરૂપ બની શકે છે. તમારી પ્રમાણિકતા અને સમાજની પ્રતિષ્ઠાના આધાર ઉપર લોન મેળવી શકો છો. તમારી વક્તૃત્વ શક્તિ એક સફળ વકીલ, માર્કેટીંગમેન, નેતા અથવા પ્રોફેસર બનવાના તમારા ધ્યેયને ખુબ જ મદદરૂપ થઈ પડે છે. તમારી દરેક શક્તિની યોગ્ય મુલવણી કરી તેનો ઉપયોગ કરતા રહો.

જીવનમાં ધ્યેય રાખવું જરૂરી છે ધ્યેયનાં આધારે જીંદગીને નવી દિશા તરફ વાળી શકાય છે.

(સાભાર : વ્યક્તિત્વ વિકાસ)

પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારે સમર્પણ કરતાં શીખવું પડે છે.

મહિલાઓને ધારાગૃહમાં અનામત

મહિલાઓ માટેની અનામતનો ખરડો એ ઉજવણીનો અવસર છે. તે માત્ર રાજયસભામાં જ પસાર થયો છે. અને લોકસભામાં પસાર થવાનો બાકી છે, અને કદાચ એ વધારે મુશ્કેલ પણ છે. પરંતુ આ પ્રથમ પગલુ પણ મોટી ઉજવણીનો અવસર છે જે માત્ર મહિલાઓ માટે જ નહીં, પણ આ દેશમાં તમામ ન્યાયપ્રિય લોકો માટે છે.

લગભગ છેલ્લા ૧૪ વર્ષથી લોકસભા અને રાજયોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત બેઠકો રાખવાનો મુદ્દો સતત ચર્ચાતો રહ્યો છે. ૧૯૯૨ માં ૭૩માં અને ૭૪માં બંધારણીય સુધારા મારફતે પંચાયતો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે અનામત બેઠકો રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. એ જ દિશામાં આગળ વધીને લોકસભા અને રાજયોની વિધાનસભાઓમાં પણ મહિલા અનામત દાખલ કરવા બંધારણ સુધારા કરવા સરકારો પ્રયત્નશીલ રહી છે.

દલિતો અને પછાત વર્ગોને અગાઉથી જ અનામત અપાઈ ચુકી છે અને આ વ્યવસ્થા સંપૂર્ણપણે ન્યાયોચિત છે. પરંતુ અનામતમાં પણ અનામત અપાય તો તેઓ અનામત ઉપર વધારે આધારીત બની જાય. જ્યારે પછાત વર્ગોની અલ્પશિક્ષિત કે અશિક્ષિત મહિલાઓ વિધાનસભા કે લોકસભામાં કેમ ન જઈ શકે ?

આમ પણ એ માનવુ ખોટુ છે કે પછાત વર્ગોની તમામ મહિલાઓ અશિક્ષિત છે અને ઉચ્ચ જ્ઞાતિઓની તમામ મહિલાઓને ઉચ્ચ શિક્ષણ મળેલુ છે. ઉચ્ચ જ્ઞાતિઓમાં પણ મોટી સંખ્યામાં નિરક્ષર અને અલ્પશિક્ષિત મહિલાઓ હોય છે. આપણાં દેશમાં મહિલાઓમાં શિક્ષણ ઝડપથી વધી રહ્યુ છે ભારતમાં સ્વતંત્રતાનાં સમયથી અત્યંત મહત્વનાં હોદ્દાઓ ઉપર બહુ ઓછી મહિલાઓ રહી છે. ઈન્દિરા ગાંધી દુનિયાભરમાં બહુ જ ઓછા મહિલા વડાં પ્રધાનો કે રાષ્ટ્રપ્રમુખોમાનાં એક હતાં. પરંતુ થોડીક મહિલાઓની હાજરીનો અર્થ એ નથી થતો કે જે સંખ્યામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવુ જોઈએ તે સંખ્યામાં એ છે.

ભારતની લોકશાહીને દર વર્ષ થયા તેમ છતા સંસદમાં કદી પણ ૧૧ ટકા કરતા વધારે મહિલાઓ રહી નથી. ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન હતા, સોનીયા ગાંધી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા છે, દેશનાં રાષ્ટ્રપતિ પણ એક મહિલા છે, તેમ છતા રાજકારણમાં બહુ મહિલા દેખાતી નથી. એ હકીકત જ એ બાબતનો નિર્દેશ આપે છે કે મહિલાઓ આપ મેળે આગળ આવશે એવી આશા રાખવાને બદલે કંઈક કરવુ જરૂરી છે. મહિલાઓની અનામતનો ખરડો એવો પ્રથમ કાયદો છે કે જે સંસદની અંદર સખત વિરોધનો સામનો કરે છે. મહિલા અનામત થી તમામ જાતિઓ અને ધર્મોની મહિલાઓને

સાચુ હોય તે કરો પછી નિર્ભય બની ફરો.

ન્યાય અપાવવો એ સરકારનું કર્તવ્ય છે. મહિલાઓ માટે અનામતનો જથ્થો ઓછો ન કરવો જોઈએ. અલગ અલગ જાતિઓ અને ધાર્મિક સમુદાયો માટે અનામતની અંદર અનામતની કોઈ આવશ્યકતા નથી લોકશાહીનો તકાજો છે કે બધી મહિલાઓની સાથે ન્યાય થાય અને અનામતની અંદર અનામત સિવાયની વ્યવસ્થામાં વિવિધ ધર્મો અને જાતિઓની મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે. કડવું સત્ય એ છે કે અમુક વર્ગોમાં પુરૂષો એ ઈચ્છતા નથી કે તેમની મહિલાઓ સંસદ અને વિધાનસભાઓમાં પહોંચે. તેઓ તેમની સત્તા છોડવા માંગતા નથી. જો મહિલાઓ સાંસદ અને વિધાનસભ્ય બને તો તેઓ પોતાના અધિકારો વિશે વધારે જાગૃત થાય, ઉંચા અવાજે બોલવાનો પ્રયત્ન કરે અને પારીવારીક કે સામાજિક સમસ્યાઓમાં તેમનો અભિપ્રાય મહત્વનો બને. આ સંભાવના જ પુરૂષોના અહમને ઠેસ પહોંચાડે છે. મોટા હોદ્દા ઉપર થોડીક જ મહિલાઓ પહોંચી એનું કારણ તો એ છે કે રાજકીય પક્ષોમાં વધારે મહિલાઓને લાવી શક્યા નથી અને હજુ સમાજ પિતૃસત્તાક વ્યવસ્થાની વિચારધારા ધરાવે છે. આપણી સંસ્કૃતિ પુરૂષોનાં વર્ચસ્વવાળી અને પુરૂષપ્રધાન છે. રાજકારણમાં જોડાવું એ મહિલાઓ માટે આસાન નથી. કેટલાક દેશોમાં અનામતનિતી અમલમાં મુકી છે. તેથી મહિલાઓ માટે

અનામત હોવી જરૂરી છે. મહિલાઓ અસરકારક બને તે માટે લઘુત્તમ ૩૩ ટકા અનામત હોવી જોઈએ. કેટલાક દેશોમાં રાજકીય પક્ષોએ અનામતની નિતી અમલમાં મુકેલી છે. યુરોપમાં મહિલાઓ માટે અનામત છે, નેપાળમાં ૩૩ ટકા અને પાકિસ્તાનમાં ૨૨ ટકા મહિલા સાંસદો છે. લોકશાહીતો એ કહેવાય કે તમામ વર્ગોને દેશનું ભાવિ નક્કી કરવાની તક મળે. મહિલા અનામત બીલ સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાની દિશામાં એક નોંધપાત્ર કદમ છે.

(સાભાર - વિચાર)

માસ દરમ્યાન થયેલ કામગીરી

૧/	ટીમ મીટીંગ -ખાંભા
૪/	હેન્ડીકેપ વર્કશોપ-અમરેલી
૪-૭/	ટ્રેઈનીંગ ઓન ગુડ ગવર્નસ
૬/	રેડીયો કાર્યક્રમ-અમદાવાદ
૮/	કોર ટીમ મીટીંગ - અમદાવાદ
૧૨-૧૪/	ટીઓટી તાલીમ- અમદાવાદ
૧૭/	સજીવ ખેતી તાલીમ -રાજકોટ
૨૩/	ટીમ મીટીંગ - અમરેલી
૨૫-૨૬/	દિકરી સમાનતા માટેની કાર્ય શિબીર-અમદાવાદ
૨૫/	યુવા પ્રતિનિધી બેઠક - ખાંભા
૨૫/	વર્ષા વિમાની તાલીમ- ખાંભા
૨૮/	એકલનારી મંચ મીટીંગ-અમદાવાદ
૨૯/	સજજતા સંઘની બેઠક-સાયલા

લીધેલ નિર્ણય સાચો હોય તો દ્રઢતાથી વળગી રહો.

સાધારણ સભા

અમરેલી જિલ્લા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી લી. અમરેલીની વાર્ષિક સાધારણ સભા તારીખ ૧૩/૦૬/૨૦૧૦ નાં રોજ ૧૬-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. નીચે દર્શાવેલ કાર્યસૂચિ મુજબના કામકાજ માટે મળશે તો તમામ સામાન્ય સભ્યોએ ઉપસ્થિત રહેવા વિનંતી છે.

સ્થળ : ૨૬-ઓમનગર(૩), જીઆઈડીસી પાછળ, હનુમાનપરા રોડ, અમરેલી.

કાર્યસૂચિ

૧. ગત સાધારણ સભાની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલી આપવા બાબત.
૨. વર્ષ ૨૦૦૯-૧૦ના વાર્ષિક હિસાબ, અંદાજપત્ર, આયોજન તથા વાર્ષિક અહેવાલની મંજૂરી બાબત.
૩. વ્યવસ્થાપક કમિટીમાં થયેલ કાર્યવાહીને બહાલી આપવા બાબત
૪. આગામી વ્યવસ્થાપક કમિટીની રચના કરવા બાબતે
૫. અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય તે

તા. ૩૦/૦૫/૨૦૧૦

પ્રમુખ

માહિતી અધિકાર હેલ્પલાઈન : ૯૯૨૪૦૮૫૦૦૦

Printed, published and edited by Hardik Dhirajlal Vagadia on behalf of Educational & Social Welfare Centre, Published from Tapak Karyalay, 26-Omnagar-3, Hanumanpara Road, Amreli and printed at Geeta Graphics, F-1 Sahjanand market, Station road, Amreli.

Post Reg. No. L2/41/G-AMI-91/2008
Valid Upto 31/12/2011

RNI No. GUJGUJ/1999/01521
Date Of Issue 1st of month



Book -Post, Printed Matter

ટપક કાર્યાલય :

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર,
૨૬, ઓમનગર(૩), હનુમાનપરા રોડ,
ગોકુલ પાર્ક સામે, અમરેલી-૩૬૫ ૬૦૧.

Tel/Fax : 02792-223525

E-mail : tapak@sskkamreli.org website: www.sskkamreli.org

વ્યક્તિને પોતાના પગ પર ઉભા રહેવાની શક્તિ આપે તે જ સાચુ શિક્ષણ.